

Seat No. : \_\_\_\_\_

# AJ-101

April-2022

LL.B., Sem.-VI

## F-313 : Forensic Science Law & Crime Detection Methods

Time : 2 Hours]

[Max. Marks : 60

સૂચનાઓ : (1) બધા પ્રશ્નો સમાન ગુણ ધરાવે છે.

(2) પ્રશ્નપત્રમાં આપેલ પ્રશ્ન ક્રમાંક તમારી ઉત્તરવહીમાં લખો.

(3) તમારા જવાબના સમર્થનમાં નિર્ણિત ચૂકાદાઓ ટાંકો.

(4) ગમે તે ત્રણ પ્રશ્નોનાં જવાબ આપો.

1. ફોજદારી ન્યાયિક પદ્ધતિમાં ન્યાય સહાયક વિજ્ઞાનનો અર્થ, કાર્યક્ષેત્ર અને તેના મહત્ત્વને કેસ લો સહિત વિગતે સમજાવો.
2. “ભારતનું ન્યાય સહાયક વિજ્ઞાન કોઈપણ પ્રકારના સાચબર ગુન્હાઓનું પગે શોધવામાં સંપૂર્ણ સક્ષ્મ છે.” – આ વિધાનને કેસ લો સાથે સમજાવો.
3. ડી.એન.એ. પ્રોફાઈલીંગ ટેસ્ટ અને તેના મહત્ત્વને નિર્ણિત કેસ લો સહિત વિગતે સમજાવો.
4. બનાવટી દસ્તાવેજો બનાવવાના કેસોને શોધી કાઢવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા અને તેના કાર્યક્ષેત્રને નિર્ણિત કેસ લો સહિત વિગતે સમજાવો.
5. નાર્કો એનાલીસીસ ટેસ્ટ અને તેની બંધારણીયતાને કેસ લો સહિત વિગતે સમજાવો.
6. લાઈ ડીટેક્શન ટેસ્ટની કાર્ય પદ્ધતિ અને ઉપયોગિતાને કેસ લો સહિત વિગતે સમજાવો.

Seat No. : \_\_\_\_\_

# AJ-101

April-2022

LL.B., Sem.-VI

## F-313 : Forensic Science Law & Crime Detection Methods

Time : 2 Hours]

[Max. Marks : 60

- Instructions :** (1) All questions carry equal marks.  
(2) State same question number in your answer book which is stated in the question paper.  
(3) Cite authorities in support of your answers.  
(4) Attempt any **three** questions.

1. Explain in detail the meaning, scope and importance of the Forensic Science in Criminal Justice System with case laws.
2. “Forensic Science in India is fully equipped to meet with any type of cyber crimes.” Explain this statement with case laws.
3. Explain in detail the DNA profiling test and its importance with case laws.
4. Explain in detail the role and scope of the Forensic Science for the detection of the various types of forgery with case laws.
5. Explain in detail the Narco Analysis test and its constitutionality with case laws.
6. Explain in detail the process and advantage of Lie detection test with case laws.

\_\_\_\_\_